



Gujarat Narmada Valley Fertilizers & Chemicals Limited

CIN : L24110GJ1976PLC002903

An ISO 9001, ISO 14001, ISO 45001 & ISO 50001 Certified Company

P.O. Narmadanagar - 392015, Dist. Bharuch, Gujarat, India
Ph. (02642) 247001, 247002 Website: www.gnfc.in

NO. SEC/AGM/SE/
August 24, 2023

Dy General Manager
BSE Ltd.
Corporate Relationship Dept
1st Floor, New Trading Ring,
Rotunda Bldg
PJ Towers, Dalal Street, Fort
Mumbai-400 001

Co. Code: BSE - "500670"

FAX: 02642 – 247084
E-Mail: acshah@gnfc.in

The Manager
Listing Department
National Stock Exchange of India Ltd.
Exchange Plaza,
C-1, Block - "G",
Bandra-Kurla Complex, Bandra (E)
Mumbai – 400 051

Co. Code: NSE- "GNFC EQ"

**Sub.: Notices to Shareholders published in the Newspapers - Compliance under
Regulation 47 of the SEBI Listing Regulations, 2015.**

Dear Sir,

The Ministry of Corporate Affairs ('MCA') vide its Circular Nos. 14/2020 dated April 8, 2020, Circular Nos. 17/2020 dated April 13, 2020, Circular Nos. 20/2020 dated May 5, 2020, Circular Nos. 02/2021 dated January 13, 2021, Circular Nos. 21/2021 dated December 14, 2021, Circular Nos. 02/2022 dated May 05, 2022 and Circular Nos. 10/2022 dated December 28, 2022 (collectively referred to as 'MCA Circulars') and Securities and Exchange Board of India ('SEBI') vide its Circular Nos. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated May 12, 2020, Circular Nos. SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated January 15, 2021, Circular Nos. SEBI/HO/CFD/CMD2/CIR/P/2022/62 dated May 13, 2022 and Circular Nos. SEBI/HO/CFD/PoD-2/P/CIR/2023/4 dated January 05, 2023 (collectively referred to as 'SEBI Circulars'), have permitted the holding of Annual General Meeting through Video Conferencing ('VC') or Other Audio-Visual Means ('OAVM'), without the physical presence of the Members at a common venue. Therefore, Annual Report for the FY 2022-23 along with Notice of AGM will be sent through emails only at registered email address of the Shareholders of the Company.

In view of the aforesaid provisions, the Company has published, Notices in newspapers viz., Business Standard, Ahmedabad Edition (In English) and Loksatta Jansatta Vadodara Edition (In Gujarati) informing Shareholders to update their Email address, Permanent Account Number and Bank Account details and to provide 15H / 15G / 10F or relevant forms for non-deduction of Tax on payment of dividend.

We submit herewith copy of the notices published in the above newspapers, pursuant to the Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, for your record please.

The advertisement may also be accessed on the website of the Company www.gnfc.in.

We request you to kindly take note of the above.

Thanking you,

Yours faithfully,
For GUJARAT NARMADA VALLEY FERTILIZERS & CHEMICALS LTD

ASHWINKUMAR
CHIMANLAL SHAH

Digitally signed by
ASHWINKUMAR CHIMANLAL
SHAH
Date: 2023.08.24 10:37:52 +05:30

CS A C SHAH
COMPANY SECRETARY & GM (LEGAL)

STATE BANK OF INDIA

Stressed Assets Management Branch : Paramaidih Complex, 2nd Floor, Opp. V.S. Hospital, Ellisbridge, Ahmedabad-380006. Phone: 079-26580794, Fax: 079-26581137, E-mail: team3samb.ahm@sbi.co.in
Authorised Officer's Name : Shri Ajay Kumar Singh, Mob : 8454046200

SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTIES

Appendix - IV-A[See Provision to rule 6 (2) and rule 8 (6)]

E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with provision to Rule 6(2) and 8(6) of the security interest (enforcement) Rules, 2002

Notice is hereby given to the public in particular to the Borrower(s) and Guarantor(s) that the below described movable and immovable properties hypothecated / mortgaged / charged to the Secured Creditor. The Physical Possession of which has been taken by the Authorised officer of State Bank of India, the Secured Creditor will sale the property on "As is Where is", "As is What is" and "Whatever there is" basis on 12-09-2023 for recovery of Rs.19,58,30,277/- as on 17.01.2018 along with interest, expenses & costs thereon and thereafter of SBI asked to pay vide demand Notice dated 17.01.2018, Less : Recoveries thereafter due to the secured creditor from M/s. SHAMROCK CHEMIE PRIVATE LIMITED (Borrower) and i. Shri Paresch Dayalji Patel ii. Legal heirs of Late Brijesh J Patel Minaxiben Brijeshbhai Patel iii. Legal heirs of Late Brijesh J Patel Kashish Brijeshbhai Patel, iv. Legal heirs of Late Brijesh J Patel Dhruv Brijeshbhai Patel, v. Legal heirs of Late Brijesh J Patel Gauri Jayantibhai Patel.

Date & Time of public E-Auction 12.09.2023 from 11:00 AM to 04:00 PM

with unlimited extension of 10 minutes each.

Lot No.	Property ID	Detail of Property	Reserve Price Rs.	Earnest Money Deposit (Rs.)	Bid increase Amount (Rs.)	Date & time of inspection
2	SBIN20000 4797795	Factory Land & building situated at Survey no. 34 35 44, Near GSPC Gas station, Tarapur - Kanavada Road, at Changada Taluka-Tarapur Dist - Anand, Gujarat. Admeasuring Total Area 13877 Sq.Mtr.	2,60,00,000/-	26,00,000/-	50,000/-	02.09.2023 Time 11:00 am to 02:00 pm

Encumbrance: To the best of knowledge and information of the Authorised Officer, there is no encumbrance advised to bank. The intending bidders should make their own independent enquiries regarding the encumbrances, title of property/ies put on auction and claims/rights /dues /affecting the property prior to submitting their bid. The e-Auction advertisement does not constitute and will not be deemed to constitute any commitment or any representation of the bank. The properties are being sold with all the existing and future encumbrances whether known or unknown to the bank. The Authorised officer / Secured Creditors shall not be responsible in any way for any third party claims/rights/dues.

Sale confirmation will be subject to consent of mortgagor/borrower if auction do not fetch more than reserve price as per provision of SARFAESI Rule 9 (2).

For detailed terms and conditions of the sale, please refer to the link provided in State Bank of India, the Secured Creditor's Website www.sbi.co.in, <https://www.mstcecommerce.com/auCTIONHOME/ibap/index.jsp>, <https://ibapi.in> or contact -AGM/CLO 8454046200 & CO 9427223984

This notice should also be considered as 15 days notice to the Borrower/ Guarantors / Mortgages under rule 8(6) & 8(2) of the security interest (enforcement) rule 2002

Date : 24.08.2023, Sd/- Authorized Officer,
Place : Ahmedabad State Bank of India.

Gujarat Narmada Valley Fertilizers and Chemicals Limited

An ISO 9001, ISO 14001, ISO 45001 & ISO 50001 Certified Company
Regd. Office: P.O.Narmadanagar - 392015, Dist: Bharuch (Gujarat), India, CIN: L24110GJ1976PC002903,
Tel: 02642 202208, 202227, Fax No.:02642 247084, E-Mail: investor@gnfc.in Website: www.gnfc.in

NOTICE TO SHAREHOLDERS FOR 47th ANNUAL GENERAL MEETING (AGM) TO BE HELD THROUGH VIDEO CONFERRING (VC) / OTHER AUDIO VISUAL MEANS (OAVM), AND REGISTRATION/UPDATION OF EMAIL ID, BANK MANDATE, MOBILE NUMBER.

1) 47th Annual General Meeting (AGM) of the Company through VC/OAVM:

NOTICE is hereby given that the 47th Annual General Meeting ("AGM") of Gujarat Narmada Valley Fertilizers & Chemicals Limited ("the Company") will be held on Tuesday, 26th September, 2023 at 03:00 P.M. (IST) through Video Conferencing ("VC") / Other Audio-Visual Means ("OAVM"), in compliance with all the applicable provisions of the Companies Act, 2013 and the Rules made thereunder and the Securities and Exchange Board of India ("SEBI") (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, (the SEBI Listing Regulations) the Ministry of Corporate Affairs ("MCA") vide its Circular dated May 5, 2020 read with Circulars dated April 8, 2020, April 13, 2020, Circular dated January 13, 2021, Circular dated December 14, 2021, Circular dated May 5, 2022 and Circular dated December 28, 2022 (collectively referred to as "MCA Circulars") and Securities and Exchange Board of India ("SEBI") vide its Circular dated May 12, 2020, Circular dated January 15, 2021, Circular dated May 13, 2022 and Circular dated January 5, 2023 (collectively referred to as the "SEBI Circulars"), to transact the business set out in the Notice convening the AGM.

The Shareholders can join and participate in the AGM through the VC/OAVM facility only. The instructions for joining 47th AGM and the manner of participation in the remote electronic voting through the e-voting system during the 47th AGM are provided in the Notice of the 47th AGM. Shareholders participating in the AGM through VC/OAVM shall be counted for the purpose of reckoning the Quorum under Section 103 of the Companies Act, 2013 (the Act).

2) Dispatch of Notice of the 47th AGM and Annual Report for the Financial Year 2022-23 through Electronic mode only:

The Notice of 47th AGM and the Annual Report for the FY 2022-23 including the Financial Statements for the Financial Year 2022-23 ended on 31st March, 2023, will be sent to all the Shareholders of the Company whose E-mail addresses are registered with the Company's RTA/Depository Participant(s) in accordance with the MCA Circulars and the SEBI Circulars. The Notice of 47th AGM and the Annual Report will be available on the Website of the Company Viz., www.gnfc.in and Website of the RTA Viz., <https://evoting.kfintech.com>. It is also available on the Website of the Stock Exchanges, where the Equity Shares of the Company are listed, i.e. BSE Limited at www.bseindia.com and National Stock Exchange of India Limited at www.nseindia.com.

3) Registration/ updation of E-mail Id, Electronic Bank Mandates and Mobile Number:

- Manner of Registering/updating E-mail Id:**
- (a) Shareholders holding shares in Physical Mode who have not registered/updated their email address with the Company can get the same registered by sending following documents by email at inward.ris@kfintech.com or by writing to the Registrar and share Transfer Agent of the Company, viz., Kfin Technologies Limited ("Kfintech"):
 - A signed request letter mentioning your name, folio number and complete address;
 - Self-attested scanned copy of I. tax PAN Card; and
 - Self-attested scanned copy of any document (Such as AADHAR Card, Driving License, Election Identity Card, Passport) in support of address, as registered with the Company.
 - (b) Members holding shares in Demat mode are requested to update their e-mail address with their respective Depository Participant, where DematAccount is maintained.

Manner of Registering/updating Bank Mandates:

- (a) The Shareholders holding shares in Physical mode who have not updated their mandate for receiving the dividends directly in their Bank accounts through Electronic Clearing Service or any other means ("Electric Bank Mandate"), can register their Electronic Bank Mandate to receive Dividends directly into their Bank account electronically, by sending following details/ documents by e-mail at inward.ris@kfintech.com or by writing to the Registrar and share Transfer Agent of the Company, viz., Kfin Technologies Limited ("Kfintech"):
 - Name and Branch of Bank in which Dividend is to be received and Bank Account type;
 - Bank Account Number allotted by your Bank after implementation of Core Banking System;
 - Eleven (11) digits IFSC code;
 - Self-attested scanned copy of cancelled Cheque bearing name of the Shareholder or first holder, in case the Shares are held jointly; and
 - Form No. ISR-2.
- (b) Shareholders holding shares in Demat mode are requested to update their Electronic Bank Mandate with their respective Depository Participant.

4) Registration / Updation of Mobile Number:

- For Shareholders holding shares in Demat mode: Please contact and update your Mobile no. with your respective Depository Participants, where your DematAccount is maintained.
- For Shareholders holding shares in Physical mode: Please send by e-mail at inward.ris@kfintech.com or by writing to the Registrar & Share Transfer Agent of the Company- Kfin Technologies Ltd., - a signed request letter mentioning your name, address, Folio no., Number of Shares and new Mobile number (also previous Mobile number- in case of change of Mobile number).

5) TDS on Dividend:

The Company vide its separate email communication dated 22nd August, 2023 had informed the Shareholders regarding the withholding of tax (TDS – Tax Deducted at Source) in compliance with the applicable provisions of Income Tax Act, 1961 and the Rules, as amended. The said communication also specifies the process to be followed by the Shareholders for claiming exemption from deduction of TDS subject to submission of requisite documents / declarations / forms etc. The said communication can be accessed from the Company's Website Viz., www.gnfc.in.

Shareholders are requested to upload aforementioned documents latest by 5:00 PM, 10th September, 2023 on the Website of the RTA Viz., <https://www.kfintech.com/> and also email them at inward.ris@kfintech.com in order to enable the Company to determine and deduct appropriate TDS / withholding tax rate. No communication on the tax determination/deduction shall be entertained after 10th September, 2023.

The above information is being issued for the information and benefit of all the Shareholders of the Company and is in compliance with the MCA and the SEBI Circulars.

For GUJARAT NARMADA VALLEY FERTILIZERS & CHEMICALS LTD.
Sd/- CS A C Shah
Date : 24th August, 2023. Company Secretary & GM (Legal)

APPENDIX IV [See Rule 8(1)] POSSESSION NOTICE

Whereas The undersigned being the authorized officer of the BANK OF BARODA under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13(12) read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated 14-06-2023 calling upon the borrower / Guarantor / Mortgagor Mr. Pankaj Murlihar Bachani, Mr. Rita Pankaj Bachani and Mr. Murlihar Shyamundhar Bachani to repay the amount mentioned in the notice being Rs.12,43,128/- (Rupees Twelve Lakh Forty Three Thousand One Hundred Twenty Eight Only) as on 15.04.2023 with further interest a expenses within 60 days from the date of notice/date of receipt of the said notice.

The Borrowers / Guarantor/ Mortgages having failed to repay the amount, notice is hereby given to the Borrower / Guarantors / Mortgagor and the public in general that the undersigned has taken Symbolic possession of the property described herein below in exercise of powers conferred on him/ her under Section 13(4) of the said Act read with Rule 8 of the said Rules on this 19th August 2023.

The Borrowers / Guarantors / Mortgagor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Bank of Baroda for an amount of Rs.12,43,128/- (Rupees Twelve Lakh Forty Three Thousand One Hundred Twenty Eight Only) as on 15.04.2023 and interest plus other charges thereon.

The borrower's attention is invited to provision of sub section (8) of the section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

Description of the immovable Property	
Immovable Property situated at R S No. 102/1 & 122/2 and 100/1 and 126/1 and 103 and 122/1 and 121 Paiki-1 and 121 Paiki 2 having consolidated R. S. No. 100/1, out of which, (1) on NA of lands of Con. R.S. No. 100/1 and (2) R.S.No. 101/1 its C.S. No. 1616 & 1624 of Moje Village Danteswar, Flat No. F/403, on the fourth floor, in F Building/ Tower, Darshanam Antica, Tarsali, Danteswar, Vadodara and bounded as under : East : Adjacent Open To Sky, West : Adjacent Open To Sky & Comm.Passage- Dadar, North: Adjacent Flat No. F/402, South : Adjacent Open To Sky	Place : Vadodara, Date : 19-08-2023 Authorized Officer Bank of Baroda

PUBLIC NOTICE

Notice is hereby given to the public under instruction and on behalf of our client Mr. Kuldip Kanubhai Der and Mrs. Nilamben Kuldip Der that.....

Our client is lease owner and possessor of below mention residential property declared that the Registered Deed of Assignment and its Registration Receipt registered at Sub-registrar Office Ankleshwar described as under:

Description of Deed	Seller	Purchaser
Vide reg. no. 9239/2016 dt. 03/10/2016	M/s. Savan Co.-op. Hsg. Soc. Ltd. Secretary Mr. Nitin Bharatibhai Virani	Mr. Nilesh Vrajlal Dudhra

Above mention registered Deed along with Registration Receipt was lost or misplaced from his possession and/or not traceable.

Description of Property

All the piece and parcel of non-agriculture industrial property bearing R. Sr. No. 287 paikie 288 paikie Plot No. H/3192 admeasuring area 1479.96 Sq.Mtrs. paikie in Building "A" on fourth floor Flat No. A/403 admeasuring built up area 59.57 Sq.Mtrs. undivided share of land 26.43 Sq. Mtrs. in "Savan Co.-op. Hsg. Soc. Ltd." within the Village limits of Bhadkodara, Ta. Ankleshwar, Dist. Bharuch, State Gujarat.

Any Person's, Bank, Society, Institution, Trust, Group etc. owning any Right of Ownership or Possession or Lien, Claim of whatsoever nature in respect of above said property by way of sale, assign, exchange, mortgage, charge, gift, trust, maintenance, inheritance lease are hereby requested to make the same known in writing with documentary evidence within period of SEVEN DAYS from the date of publication of this notice. Upon expiry of which it shall be presumed that there are no claims and that claims, if any have been waived off and issue a Title Certificate in respect of same.

Parin V. Patel (Advocate)
Office : F.F. - 16, Rajkamal Arcade, Opp. Mamiatdar Office,
GIDC, Ankleshwar - 393 002. Mob. No. +91 98255 94695

STATE BANK OF INDIA

Stressed Assets Recovery Branch (SARB) : 7th Floor, Paradise Complex, Near Kala Ghoda Circle, Sayajigunj, Vadodara - 390020

DEMAND NOTICE u/s 13 (2) SARFAESI ACT, 2002

A notice is hereby given that the following Borrower/ Shri Rakesh Mohanlal Jain, Rajesh Mohanlal Jain and Shri Kushal Bhanwarial Luniya (Borrower), have defaulted in the repayment of principal and interest of the loans facility obtained by them from the Bank and the loans have been classified as Non-Performing Assets (NPA). The notices were issued to them under Section 13(2) of Securitization and Re-construction of Financial Assets and Enforcement of Security Interest Act 2002 on their last known addresses, but they have not returned unserved and as such they are hereby informed by way of this public notice.

Sr. No.	Name of the Borrower(s)	Details of Properties/ Address of Secured Assets to be Enforced	Date of Notice	Date of NPA	Amount Outstanding (As on Date of Notice)
1.	Shri Rakesh Mohanlal Jain , Rajesh Mohanlal Jain and Shri Kushal Bhanwarial Luniya	All that piece and parcel of property being flat no. D-1002 on the 10th Floor of the Building no. D known as Shankeshwar Heights, constructed on land admeasuring 5890 sq mtrs, bearing R.S. No. 372, Block No. 345, T.P. Scheme No. 14 (Pal), Final Plot No. 82, Village Pal, Taluka Adajan, Surat, (built up area admeasuring about 1513.96 Sq.Ft. i.e. 140.65 sq mtrs along with undivided proportionate share in undemeth land) owned by Shri Rakesh Mohanlal Jain, Shri Rajesh Mohanlal Jain & Shri Kushal Bhanwarial Luniya Bounded As Follows: East: Open land, West: Garden & Building C, North: Open land, South: Flat No. D-1001.	29.07.2023	22.01.2021	Rs. 1,24,50,272.22 as on 29.07.2023 with further interest and incidental expenses and costs thereon..

The borrowers attention is invited to provisions of Sub-section(8) of Section 13 of the Act, in respect of time available to redeem the secured assets.
Date : 24.08.2023
Place: Surat Authorized Officer
For, State Bank of India , SARB VADODARA.

M.P. STATE COOPERATIVE DAIRY FEDERATION LTD.

Dugtha Bhavan, Habibganj, Bhopal - 462024 (M. P.)
Telephone No. : 0755- 2601517, E-mail : ho.mpcdf@nic.in, Website : www.sanchidairy.com

E-TENDER NOTICE

MP State Cooperative Dairy Federation Ltd. (MPCDF), Dugtha Bhavan, Habibganj, Bhopal, an apex cooperative organization in Madhya Pradesh, invites online tender for appointing Consultant for NABL accreditation (ISO/IEC 17025:2017) & FSSAI Recognition (Level-1) Laboratory from reputed established organizations/Consultancy firms/agencies. The tender document containing the terms and conditions can be downloaded and uploaded through website <http://www.mptenders.gov.in> The uploaded tender will be opened in office of MPCDF, Bhopal as indicated in tender time schedule.

The detailed Tender form can be seen (for immediate reference) at our HO website - www.sanchidairy.com. Any changes in tender document will be notified on above website only and therefore, bidders are requested to update themselves by watching this site regularly. The Managing Director, MPCDF reserves all the rights to accept or reject any or all the bids, without assigning any reasons thereof at any stage of tender process.

The cost of tender documents is Rs. 1000/- (Rupees one thousand only). Payable at mptenders.gov.in.

KEY INFORMATION

Pre Bid Meeting Date, Time & Venue	Last Date & Time for Purchasing Tender Form Online	Last Date, Time for Submission of Technical and Financial Bid Online	Date, Time & Venue for Opening Technical Bid	Date, Time & Venue for Opening Financial Bid	EMD required to be submitted online (in INR)
12:00 PM 29.08.2023 MPCDF, Habibganj, Bhopal, MP	02:00 PM 18.09.2023	03:00 PM 18.09.2023	12:00 PM 19.09.2023 MPCDF, Habibganj, Bhopal, MP	12:00 PM 25.09.2023 MPCDF, Habibganj, Bhopal, MP	Rs. 50,000/-

M.P. Madhyam/111568/2023 MANAGING DIRECTOR

STATE BANK OF INDIA

Stressed Assets Recovery Branch (SARB) : 7th Floor, Paradise Complex, Sayajigunj, Vadodara-390020, Phone : 0265-22291/82, Email : sbi.10059@sbi.co.in

PUBLICATION OF NOTICE REGARDING POSSESSION OF PROPERTY U/S 13(4) OF SARFAESI ACT 2002

Whereas, the undersigned being the Authorised Officer of State Bank of India, Stressed Assets Recovery Branch, 7th Floor Paradise Complex, Sayajigunj, Vadodara-390020 under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of powers conferred under section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002, issued a demand notice dated mentioned against each account and stated hereinafter calling upon the Borrower/Co-borrower/Guarantor to repay the amount mentioned in the notice being below mentioned with further : at the contractual rate on aforesaid amount together with incidental expenses, costs, charges within 60 days from the date of receipt of the said notice.

The Borrower having failed to repay the amount, notice is hereby given to the borrowers, legal heirs (known-unknown), legal representatives (known-unknowns), guarantor and the public in general that, the undersigned has taken Physical Possession of the properties described herein below in exercise of the powers conferred on him under section 13(4) of the said Act read with Rule 8 of the said Act on the dates mentioned against each account.

The Borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the STATE BANK OF INDIA for an amount and interest thereon.

Sr. No.	Name of Account / Borrower	Demand Notice & Outstanding Amount in Rs	Description of the Property Mortgaged / Charged	Date & Type of Possession	Order No. / Order Date
1	Shri Ghanshyam Purushotambhai Rajput	31.12.2022 Rs. 48, 27,128.81 as on 31.12.2022	All that piece and parcel of Flat No. E-402, 4th Floor Param Paradise Bih Icon Temple R.S.No. 825 Paiki-1, TP No. 83, F.P.No.18.C.S. No.151/12, Moje – Gofri-Vadodara. District and Sub District-Vadodara. Built up area: 116.12 sq.m. Bounded As Under: West: Flat no 403, East : Common Plot, North: Flat no 401, South: Margin then Kamiyot Society.	Physical 20.08.2023	Compliance of order of Chief Judicial Magistrate, Vadodara dated 31.07.2023 in CRMA J No. 2091 of 2023.
2	Shri Jitendra Shyambabu Sharma & Smt. Garima Jitendra Sharma	02.12.2022 Rs.57,55,183.63 As on 02.12.2022	All that piece and parcel of Plot No. B-196, Blue's Spring Field, Opp Gayatri Temple, Block No.29 (old R.S. No. 74) having area of 70.94 Sq. Mts with proportionate road and Common plot 47.23 sq.mts. Total area 116.17 sq.mts. Moje- Pavlepur, New Waghodia Road, Khatamba, Vadodara owned by Shri Jitendra Shyambabu Sharma and Smt Garima Jitendra Sharma. Bounded As Under : West: Sub Plot No. B-173, East : 7.5 mtr internal Road, North: Sub Plot No B-197, South: Sub Plot No. B-195.	Physical 21.08.2023	Compliance of order of Chief Judicial Magistrate, Vadodara dated 31.07.2023 in CRMA J No. 2092 of 2023.
3	Shri Shrikant Bharatw Khochar	06.12.2022 Rs. 22,33,533.54 as on 05.12.2022	All that piece and parcel of Flat no G-202, 2nd Floor, Tower-G, Eshanya Florence, R.S. No. 364, Moje/Gandhinagar Registration District: Vadodara. Sub Registration District: Vadodara. Built up Area: 77.20 Sq Mtr. Bounded As Under : West: R.S. No. 368, East : Flat no G-201, North: Flat no G-203, South: Common Plot.	Physical 23.08.2023	Compliance of order of Chief Judicial Magistrate, Vadodara dated 31.07.2023 in CRMA J No. 2215 of 2023.

Date : 24.08.2023
Place : Vadodara Authorized Officer
State Bank of India, SARB Vadodara

E-Auction Sale Notice

E-Auction Date : 12.09.2023 | Time : 02:00 PM to 06:00 PM

E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with provision to Rule 6 (2) & 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002.

Notice is hereby given to the public in general and in particular to the Borrower (s), Mortgagor(s) and Guarantor (s) that the below described immovable property mortgaged/charged to the Secured Creditor, possession of which has been taken by the Authorised Officer of Bank of Baroda, Secured Creditor, will be sold on "As is where is", "As is what is", and "Whatever there is" basis for recovery of dues in below mentioned account(s). The details of Borrower/s/Mortgagor/Guarantor/s/Secured Asset/s/Dues/Reserve Price/E-Auction date & Time, EMD are mentioned below

Sr. No.	Branch	Name of Borrower / Mortgagor	Property description	Total Dues (In Lakh)	Reserve Price (In Rs.)	EMD Amount (In Rs.)	Status of Possession	Contact for Property Inspection
1.	KADODARA	M/s KRINAL CORPORATION (Prop.: Ketanbhai Dhirubhai Mandviya) & Guarantor : Mrs. Kiranben Ketanbhai Mandviya	Registered equitable mortgage of commercial shop situated at all that piece and parcel of immovable property bearing shop no.141, on the 1st floor, in the building known as "Central Bazaar" of village : Vesu, Taluka : surat city, District : surat stands in the names of Ketanbhai Dhirubhai Mandviya.		6,40,000	64,000	PHYSICAL	Mr. Raj Christopher Ansa 8980026708
			Registered equitable mortgage of commercial shop situated at all that piece and parcel of immovable property bearing shop no.23 , on the Ground Floor, in the building known as "Central Bazaar" of village : Vesu, Taluka : surat city, District : surat stands in the names of Ketanbhai Dhirubhai Mandviya.		9,95,000	99,500	PHYSICAL	
			Registered equitable mortgage of commercial shop situated at all that piece and parcel of immovable property bearing shop no.115, on the 1st floor, in the building known as "Central Bazaar" of village : Vesu, Taluka : surat city, District : surat stands in the names of Ketanbhai Dhirubhai Mandviya		6,45,000	64,500	PHYS	

